

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રમ્પટન ચંદ્ર આધિન (લ્યુનર) નુતનવર્ષ ઉજવશે અને વાઘના વર્ષને (ચર ઓફ દ ટાઈગર) આવકારશે

બ્રમ્પટન, ઓન્ટારિયો (24 જાન્યુઆરી 2022) – સીટી ઓફ બ્રમ્પટન સમાજને ચંદ્ર આધિન નવા વર્ષને ઉજવવા અને વાઘના વર્ષનું સ્વાગત કરવા આમંત્રિત કરે છે જેમાં રૂબરૂ તેમજ ઓનલાઈન પ્રોગ્રામો હાથ ધરાશે જેની શરૂઆત 2જી ફેબ્રુઆરીના રોજથી થશે. 2022 વાઘનું વર્ષ ગણવામાં આવે છે – જે શક્તિ, નસીબ અને આત્મવિશ્વાસ સૂચવે છે.

લ્યુનર ચર આર્ટ સ્ક્વેર

ડેઈલી ટાઈમ્સ સ્ક્વેર, 33 કિવન સ્ટ્રીટ, વેસ્ટ

ફેબ્રુઆરી 2 - 14

બ્રમ્પટન ચાઈનીઝ બિઝનેસ અસોસિએશન સાથેની ભાગીદારીમાં એક અલ્પકાલિક જાહેર કલા પ્રદર્શન સિટી હોલની બહાર ડેઈલી ટાઈમ્સ સ્ક્વેરમાં યોજાશે જે કેનેડિયન ધરોહર અને પૂર્વ એશિયાઈ સંસ્કૃતિને વધાવશે. ફેબ્રુઆરી 2 થી 4 સુધીના પ્રદર્શનમાં [અબિઓલા ઇડોવુ \(Abiola Idowu\)](#), [ખાઉલા સિદ્દિક \(Khaula Siddique\)](#), [સ્કોટ ગીવન \(Scott Given\)](#) અને ક્રિસ મુનુસામી (Chris Munusami) જેવા ચાર સ્થાનિક કલાકારોનો સમાવેશ થશે.

લ્યુનર ન્યુ ચર વર્ચુઅલ ઉજવણીઓ

ફેબ્રુઆરી 1-4 સુધી સિટી ઓનલાઈન ઉજવણી યોજાશે અને સમુદાય લ્યુનર નુતન વર્ષ વિશે વધુ જાનકારી મેળવી શકાય અને તેને માણી શકાય તેમજ દરેક કલાકારના વિડિયો ઇન્ટરવ્યુ હાથ ધરશે જ્યાં તેઓ પોતાના પ્રેરણાસ્ત્રોત અને પ્રક્રિયા અંગેના વિચારો રજૂ કરી શકે અને સાથે જ પારંપરિક પૂર્વ એશિયાઈ કાર્યક્રમો પણ થશે.

લ્યુનર નુતન વર્ષની ઉજવણી વિશે વધુ માહિતી માટે મુલાકાત લો brampton.ca/lunarnewyear

સીટી ઓફ બ્રમ્પટન તેમના ઉદાર ઇવેન્ટ પ્રાયોજક અલગોમા યુનિવર્સિટી અને RBCનો આભાર માને છે.

સુવાક્યો

"સીટી ઓફ બ્રમ્પટન વતી હું બધાને આરોગ્યપ્રદ અને સમૃદ્ધિમય વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. આપણે જ્યારે વાઘના વર્ષને આવકારી રહ્યા છીએ ત્યારે લ્યુનર નવ વર્ષ અને બ્રમ્પટનના વૈવિધ્યને વધાવતા આનંદ થાય છે અને તે પણ બ્રમ્પટનના ડેઈલી ટાઈમ્સ સ્ક્વેરમાં આવા અદ્ભુત જાહેર કલા પ્રદર્શનના માધ્યમથી. ડુંગ લિ ફેટ ચોય!"

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"બ્રમ્પટન મોઝેક છે અને અમને આ પ્રસંગો ઉજવતા અને સમાજને થતા યોગદાનથી ખરેખર આનંદની લાગણી થાય છે. જેઓ લ્યુનર નુતન વર્ષ ઉજવી રહ્યા છે તેમને બધાને હું શુભેચ્છાઓ પાઠવું છું તે પ્રાર્થના સાથે કે 2022 દરેક જાણ માટે શુભ નીવડે."

- હરકિરત સિંઘ, સિટી કાઉન્સિલર, વોર્ડ 9 અને 10, પ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સીટી ઓફ બ્રમ્પટન

"બ્રમ્પટનનો વૈવિધ્યસભર સમુદાય આ શહેરને ખાસ બનાવે છે. અમારા કર્મચારીઓ અને સમસ્ત સમાજ માટે નુતન વર્ષના અભિનંદન અને 2022 માટે સારા આરોગ્યની શુભેચ્છાઓ."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક:

પ્રભજોત કૈન્થ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ (Media and Community Engagement)

વ્યૂહાત્મક સંવાદ (Strategic Communication)

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca